



## પ્રકરણ - ૧

## મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.



### વિષયસૂચિ:

- |  |  |
|--|--|
| ૧.૦ સ્ત્રી સ્વાસ્થ્ય શું છે ?  | ૩.૦ સ્ત્રીઓનું સ્વાસ્થ્ય નબળું હોવાના કારણો                  |
| ૨.૦ સ્ત્રીઓની આરોગ્ય સમસ્યાઓ   | ૩.૧ સમાજમાં સ્ત્રીઓનો ઉત્તરતો દરજાને<br>➢ દરેકને દીકરો જોઈએ. |
| ૨.૧ અપૂરતું પોષણ - કુપોષણ  | ➢ સ્ત્રીઓને પોતાના નિર્ણયો<br>કરવાની છૂટ નથી.                |
| ૨.૨ પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ<br>➢ જાતીય સંપર્કથી ફેલાતા રોગ<br>➢ વારંવાર સગર્ભા બનવું.<br>➢ સગર્ભાવસ્થા અને પ્રસૂતિની તકલીફો -<br>➢ ગર્ભપાતથી થતી તકલીફો -<br>અસલામત ગર્ભપાત | ➢ બેનોનું કામ<br>3.૨ અપૂરતી અને દુર્લભ તબીબી સેવાઓ           |
| ૨.૩ સામાન્ય બિમારીઓ  | ૪.૦ પરિવર્તન માટે પ્રયાસ                                     |
| ૨.૪ રોજગારી (કામ) ને લીધે થતી બિમારીઓ  | ૪.૧ સામાજિક / કૌટુંબિક ફેરફાર                                |
| ૨.૫ માનસિક આરોગ્ય  | ૪.૨ બાળકોનો સારો ઉછેરકેવી રીતે કરવો                          |
| ૨.૬ સ્ત્રીઓ પ્રતિ હિંસા  | ૪.૩ પુરુષોની મદદ લો.   |
|  | ૪.૪ ગામમાં / સમાજમાં સ્ત્રી સ્વાસ્થ્ય<br>સુધારવા શું કરશો.   |
|  | ૪.૫ આટલું તો કરો જ   |

મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

---

## ૧.૦ સ્ત્રી સ્વાસ્થ્ય શું છે ?

સ્વાસ્થ્ય શબ્દમાં રોગોની ગેરહાજરી કરતાં ઘણો વધુ અર્થ સમાયેલો છે. સ્ત્રીના સારા સ્વાસ્થ્યનો અર્થ સ્ત્રીના શરીર, મન અને ભાવનાઓની ખુશાલી છે.

જો સ્ત્રી તંદુરસ્ત હોય તો કુટુંબ અને સમાજમાં તેના ભાગે આવતી વિવિધ ભૂમિકાઓને પૂરા ઉત્સાહ અને શક્તિથી તે નિભાવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓની તંદુરસ્તી તેના જીવનના દ્રેક પાસાં પર અસર કરે છે. છતાં વર્ષોથી “સ્ત્રી સ્વાસ્થ્ય સંભાળ” ને સગર્ભાવસ્થા અને સુવાવડ માટેની સારવાર પૂરતી જ મર્યાદિત ગણવામાં આવેલ છે. અલબ્જ્ટ, આ સેવાઓ આવશ્યક છે પરંતુ તે ફક્ત સ્ત્રીઓની માતા તરીકેની જરૂરિયાતો જ ધ્યાનમાં લે છે.

આ પુસ્તકમાં અમે સ્ત્રી આરોગ્ય અંગે એક જુદો જ દાખિકોણ રજૂ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં અમે એમ માનીએ છીએ કે સ્ત્રીઓને તેમના સમગ્ર જીવનકાળ દરમ્યાન પૂરેપૂરી રીતે સર્વાંગિક આરોગ્ય સેવાઓ મેળવવાનો હક્ક છે. સ્ત્રીઓ માટેની આરોગ્ય સેવાઓ સ્ત્રીઓને તેની પત્ની કે માતા તરીકેની ભૂમિકાઓ માટે જ નહીં પણ તેના જીવનની દ્રેક સમસ્યાઓમાં મદદ કરે તેવી હોવી જેઠાંએ. બીજે અગત્યનો મુદ્દો એ છે કે, શરીર રચના ઉપરાંત સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોની સ્ત્રી સ્વાસ્થ્ય પર ઊંડી અસર થાય છે. પુરુષોના સ્વાસ્થ્ય ઉપર પણ આ પરિબળોની અસર થાય છે. પરંતુ આપણાં સમાજમાં સ્ત્રીઓને પુરુષો કરતાં નીચી ગણવામાં આવે છે માટે તેઓનું સ્વાસ્થ્ય પુરુષોની સરખામણીમાં નબળું રહે છે. જેમ કે,

- પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ ગરીબીમાં સબડે છે.
- શિક્ષણ અને આત્મનિર્ભરતા માટે જરૂરી તાલીમ પુરુષો કરતાં ઓછી સ્ત્રીઓને મળે છે.
- સ્ત્રીઓ પોતાની આરોગ્ય સંભાળ માટે જરૂરી નિર્ણયો લઈ શકતી નથી.
- પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને વિકાસનો લાભ ઓછો મળે છે.

સ્ત્રી સ્વાસ્થ્ય સુધારવું એટલે તેઓના આરોગ્યના પ્રશ્નો (સમસ્યા) ની સારવાર કરવી એ સાચું પણ જીવનની પરિસ્થિતિ સુધારવાથી સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ નિર્ણયિક ભૂમિકા ભજવી શકે છે. એક તંદુરસ્ત સ્ત્રી જ પોતાનો પૂર્ણ વિકાસ સાધી શકે છે અને સમાજમાં અર્થપૂર્ણ અને જવાબદાર નાગરિકની ભૂમિકા વધુ સારી રીતે ભજવી શકે છે. તદ્વારાંત તેના બાળકો વધુ તંદુરસ્ત બનશે, તે પોતાના કુટુંબની વધુ સારી સંભાળ રાખી શકશે અને તે સમાજને વધુ ઉપયોગી બનશે. આ રીતે જેતાં એમ લાગે છે કે સ્ત્રી સ્વાસ્થ્યની સમસ્યા તેની એકલીનો જ પ્રશ્ન નથી. સ્ત્રી સ્વાસ્થ્ય એક સામાજિક પ્રશ્ન છે.

---

## ૨.૦ સ્ત્રીઓની આરોગ્ય સમસ્યાઓ

અગાઉ જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓની આરોગ્ય સમસ્યાના મૂળમાં તેની મૂળભૂત જરૂરિયાતો વિશેની સામાજિક નિષ્કાળજી રહેલી છે. સામાજિક સ્તરે સ્ત્રીઓને સૌ પ્રથમ માનવીય અધિકારોની માપ્તિ એ તેનું આરોગ્ય સુધારવા માટેની ચાવી છે. તેમાં છૂટથી હરવું, ફરવું, બોલવું, કામ કરવું, ભણવું, ખાવું-પીવું, બિમારીમાં સારવાર મળવી, પૂરતી સામાજિક સુરક્ષા મળવી, મિલકત ઉપર અધિકાર, ઈત્યાદિ મૂકી શકાય. અહીં તેમાંની કેટલીક સમસ્યાઓને વિગતે વર્ણવી છે.

## ૨.૧ અપૂરતું પોષણ - કુપોષણ

અપૂરતું પોષણ મળવાથી છોકરીનો વિકાસ બરોબર થતો નથી અને તેને આ ૧૨ માટે ચાર વર્ષની ગંભીર સમસ્યાઓ વેઠવી પડે છે.

ગરીબ દેશોમાં સ્ત્રીઓને ઓછું પોષણ એ સર્વ સામાન્ય અને ગંભીર આરોગ્ય સમસ્યા છે. તે સ્ત્રીઓની ક્ષમતાને મર્યાદિત કરે છે. નાનપણમાં છોકરીઓને ખાવાનું ઓછું મળવાથી તેનો વિકાસ બરોબર થતો નથી. (જેને કારણે પાછળથી બાળજન્મ વખતે તકલીફ થાય છે.) તે માસિક પાળીમાં બેસવા માંડે, જુવાન બને, વધુ કામ કરતી થાય, સગર્ભ થાય અને બાળકોને ઘવડાવતી હોય ત્યારે તેની પોષણની જરૂરિયાત વધે છે. ખાવાનું પૂરતું ન મળવાથી તેનું સામાન્ય સ્વાસ્થ્ય બગડે છે. તેને નબળાઈ આવે, થાક લાગે અને પાંડુરોગ થાય. જે સ્ત્રીને કુપોષણ હોય અને ગર્ભાવસ્થા આવે, તેને વધુ લોહી વહી જવાની, ચેપ થવાની અને ઓછા વજનવાળું બાળક જન્મવાની વધુ સંભાવના (શક્યતા) છે. (જુઓ પ્રકરણ - આરોગ્ય અને આહાર.)



મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

## ૨.૨ પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ

- જતીય સંપર્કથી ફેલાતા રોગો : ક્રીને જતીય રોગ થવાનું જોખમ પુરુષો કરતાં વધારે છે કારણકે સંભોગ વખતે પુરુષનું વીર્ય ક્રીના શરીરમાં (કાયામાં) મૂકાય છે અને તેની સાથે આવતા રોગાણુ તેની યોનિની સુંવાળી સપાઈ (અંતઃત્વચા)માં થઈને તેના લોહીમાં પ્રવેશે છે. ધારીવાર ક્રીને ચેપનું કોઈ જ ચિનહે હેખાતું ન હોવાથી તેને સારવાર મળતી નથી.



ધારીવાર ક્રીઓને તે મની ઠરછ વિડ્ધ બિનસલામત રીતે જતીય સમાગમ કરવો પડે છે તેથી જતીયરોગ એક સામાજિક સમસ્યા બને છે.

આ એક સામાજિક સમસ્યા છે. ક્રી ધારીવાર બિનસલામત સંભોગ નકારી શકતી નથી. જે સારવાર ન મળે તો ક્રીને શારીરિક અને માનસિક પીડા, કાયામાં અને પેઢુમાં સોન્ને (PID), વંદ્યત્વ (સંતાન ન થવા), સગર્ભાવસ્થામાં તકલીફ અને કેન્સર થવાનું જોખમ વધે છે. વળી,

એચ.આઈ.વી./એઇડ્સ લાગે તો મરણ નીપણે છે. (જુઓ ગુપ્તાંગના ચેપ અને જતીય રોગ)

- વારંવાર સગર્ભા બનવું : દુનિયાના ધણા ભાગોમાં અર્ધાંથી વધુ ક્રીઓ ૨૦ વર્ષની થાય તે પહેલાં સગર્ભા બને છે. કુટુંબ નિયોજનનું સાધન ન અપનાવે તો આ ક્રીને બે સુવાવડ વચ્ચે તંદુરસ્ત થવાનો સમય મળતો નથી. વારંવાર સગર્ભા થવાથી તેને ભાણતર-ગણતરની તકો પણ મળતી નથી. પોતાની રીતે જીવી શકતી નથી.

સગર્ભાવસ્થા અને પ્રસૂતીની તકલીફો : છેલ્લા ૩૦ વર્ષોમાં એક વર્ષથી નાના બાળકોના (શિશુ) મરણનો આંકડો ઘટ્યો છે. જ્યારે સગર્ભાવસ્થા અને સુવાવડ (બાળજન્મ) ને કારણે મરતી ક્રીઓનો

આંકડો ઓછો થયો નથી. ગુજરાતમાં ૧૦૦૦ લુભિત બાળજન્મ થાય ત્યારે ૪-૫ ક્રીઓ મરણ પામે છે. ઉપરાંત ધારી ક્રીઓ સગર્ભાવસ્થાને કારણે લાંબા ગાળાના રોગનો ભોગ બને છે. આનો અર્થ એવો પણ થાય કે ટૂંક સમયમાં ગરીબ દેશોમાં ચોથા ભાગની ક્રીઓને સગર્ભાવસ્થા કે સુવાવડથી થતી ગંભીર માંદગીઓના ભોગ બનવું પડશે.

- ગર્ભપાતથી થતી તકલીફો : દરરોજ લગભગ ૫૦,૦૦૦ સ્ત્રીઓ/ઇકરીઓ સગર્ભવસ્થા નિવારવા વિવિધ રીતો અજમાવે છે, કારણ તેમને ગર્ભપાત માટે સત્તામત (તબીબી) સારવાર મળી શકતી નથી. તેમાંની ઘણી બધીને ફરી ગર્ભ નથી રહેતો અથવા દુખાવો, ચેપ જેવી લાંબાગાળાની બિમારીઓ લાગુ પડે છે.

#### ૨.૩ સામાન્ય બિમારીઓ

પુરુષો અને સ્ત્રીઓને સરખા જ રોગ થાય છતાં આપણા મનોસામાનિક વલણોને લીધે સ્ત્રીઓ પર તેની અસર જુદીજ થાય છે.

સ્ત્રીઓને કેટલીક બિમારીઓ પુરુષો કરતાં વધુ લાગુ પડે છે, તેનું કારણ કુપોષણ કે અતિશય શારીરિક શ્રમ હોય છે.

સ્ત્રી એની બિમારી ખૂબ ગંભીર ન બને ત્યાં સુધી તબીબી સહાય લેતી નથી કે તેને તબીબી સારવાર મળતી નથી. દા.ત. પુરુષો કરતાં સ્ત્રીઓને ટી.બી.ની સારવાર ઓછી મળે છે. દર વર્ષે ટી.બી. થી મરી જતી સ્ત્રીઓમાંથી ત્રીજી ભાગની સ્ત્રીઓને રોગની સારવાર મળતી નથી કે તેઓને ટી.બી. થયો છે એવી ખબર પણ હોતી નથી. આજકાલ દાડ અને બીડી જેવા વ્યસનોથી સ્ત્રીઓને પણ પુરુષો જેવા જ રોગ લાગુ પડે છે. (જુઓ - ટી.બી., દાડ અને બીજા વ્યસનો)

#### ૨.૪ રોજગારી (કામ) ને લીધે થતી બિમારીઓ

ઘરમાં અને ઘર બહાર કરવા પડતાં વિવિધ કામોને લીધે સ્ત્રીઓને બિમારી લાગવાનું જોખમ વધી જય છે. દા.ત. ઘરે ચૂલાના ધૂમાડાથી ફેફસાની બિમારી અને દાડી જવાની તકલીફો વધુ પ્રમાણમાં જેવા મળે છે. તેઓને પાણીથી થતી બિમારીઓ પણ જલ્દી થાય છે, કારણ કે કપડાં ધોવા, પાણી ભરવું વગેરે કામો માટે તેને આપો દિવસ પાણીમાં કામ કરવું પડે છે. કમર તથા શરીરનો દુખાવો સતત વાંકા વળીને કામ કરવાથી થાય છે, જેમ કે, ઝેતીકામ, રસોઈકામ, સિવણકામ, બળતણ લાવવું, ચાર લાવવી સફાઈ કરવી, વગેરે.



સ્ત્રીઓને ઘરમાં અને ઘરની બહાર કરવા પડતાં કામને કારણે બિમારીઓ લાગુ પડે છે. વળી સ્ત્રીઓ બમણું કામ કરે છે અને બાળઉછેરની જવાબદારી પણ તેમની જ છે. તેથી તેઓ થાકી જય છે અને તેમનું શરીર રોગ સામે લડી શકતું નથી.

મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

## ૨.૫ માનસિક આરોગ્ય

સ્ત્રીઓ અને પુરુષોને માનસિક પ્રશ્નો લગભગ સરખા જ થાય છે. પરંતુ ડીપ્રેશન (માનસિક હતાશા) જેવી બિમારી સ્ત્રીઓને વધુ થાય છે. ખાસ કરીને ગરીબ બેનો અને હિંસાના ભોગ બનતી સ્ત્રીઓને આ બિમારી વધુ થાય છે. પુરુષો કરતાં વધુ સ્ત્રીઓને આ રોગ લાગુ પડે છે છતાં સ્ત્રીઓનો ઈલાજ બરાબર થતો નથી. વળી માનસિક બિમારીનો ભોગ બનેલી સ્ત્રીને અન્ય સામાજિક પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે, જેમ કે, સાસરેથી કાઢી મૂકાય, એકલા રહેવાથી બીજા લોકો હેરાન કરે, વગેરે.



## ૨.૬ સ્ત્રીઓ પ્રતિ હિંસા

સ્ત્રીઓ પર થતી હિંસાને સામાન્ય રીતે આરોગ્ય સમસ્યા ગણવામાં આવતી નથી. પરંતુ તેનાથી સ્ત્રીઓને શારીરિક ઠિંજા, માનસિક તાણા, અપંગતા અને મૃત્યુના ભોગ પણ બનવું પડે છે. (જુઓ - સ્ત્રીઓ પ્રતિ હિંસા, બળાત્કાર અને જતીય હિંસા) સ્ત્રીઓ પર શારીરિક અને માનસિક હિંસા થવા છતાં તેઓનો જ વાંક કાઢવામાં આવે છે અને સમાજ તેમનો પ્રશ્ન ઉક્લિવામાં બહુ ઓછી મદદ કરે છે. સ્ત્રીઓને તેમના ઓળખીતા પુરુષોની હિંસા સહન કરવી પડે છે. પરંતુ તે અંગે કોઈ ફરિયાદ નોંધાવાતી નથી. તેથી પુરુષોને આ હિંસા માટે કોઈ જ શિક્ષા થતી નથી.

### સ્ત્રીઓનું સ્વાસ્થ્ય કેવી રીતે બગડે છે.

બધી સ્ત્રીઓને ઉપર જણાવેલ બધી સમસ્યાના ભોગ બનવું પડે છે એમ નથી. પણ મોટા ભાગની બેનોને તેમાંની બે કે ત્રણ સમસ્યાઓ હોય છે. દા.ત. કુપોષણ, વારંવાર સગર્ભાવસ્થા અને વધુ પડતો કામનો બોન્ટો. આમાંનો હેડ્પ્રેશ તેના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. તેથી તેનું શરીર નંખાઈ જય છે. સગર્ભાવસ્થામાં મેલેરીયા, કમળો અને પાંદુરોગ (લોહીની ડિક્કાશ) થવાથી તેની પરિસ્થિતિ વધુ કફ્ફોડી બને છે. આ બધાથી સ્ત્રીઓનું સામાન્ય સ્વાસ્થ્ય પુરુષોની સરખામણીમાં નબળું બને છે.



### ૩.૦ શ્રીઓનું સ્વાસ્થ્ય નબજું હોવાના કારણો

શ્રીઓની ઘણી બિમારીઓના સીધા કારણો શોધવા સહેતા છે. જેમકે જતીય રોગનું કારણ રોગાણું છે. છતાં આ સીધા અને દેખીતા કારણોના પાયામાં ગરીબી અને નીચું સામાજિક સ્થાન રહેલું છે.

#### શ્રીઓની ગરીબી અને અનારોગ્ય (બિમારી)

દુનિયાની દર ત્રણ શ્રીઓમાંથી બે વધુ ગરીબ હોય છે શ્રીઓ પુરુષોની સરખામણીમાં તો ગરીબ હોય છે જ પરંતુ ઘણી બેનો તો ગરીબોમાંય સૌથી ગરીબ હોય છે. લાખો શ્રીઓ તેમનાં જન્મ પહેલાં જ ગરીબીના ચકમાં ફસાય છે. તેમની માતાને ઓછું પોષણ મળવાથી તે ઓછા વજનવાળી છોકરી તરફી જન્મ લે છે, ધરમાં ભાઈની સરખામણીમાં ઓછું ખાવાનું મળે છે. ઓછું શિક્ષણ પામેલી આ છોકરી સમાજમાં મજૂરીને જ લાયક બને છે. ધરે તેઓના કામ માટે કોઈ પૈસા ન મળે, બહાર મજૂરી કરી માંડ પેટીયું રળી શકતી આ શ્રીઓ શ્રમ, ઓછું પોષણ અને સગર્ભાવસ્થાના લીધે બિમાર રહે છે.

ગરીબ રહેણી કરણીથી અનેક શારીરિક તથા માનસિક પ્રશ્નો ઉભા થાય છે. દા.ત.

- \* તેનું ધર ખરાબ છે જેમાં મળમૂત્રના નિકાલ માટે સંઢાસ-બાથર્ડમની અને પીવાના ચોખ્ખા પાણીની ખાસ સગવડ હોતી નથી.
- \* તેને ખાવાનું પૂરતું મળતું નથી અને સસ્તા અનાજની શોધમાં તેને બહુ સમય બગાડવો પડે છે. પોતાના અને બાળકોના જીવતર માટે તેને ખૂબ સંધર્ષ કરવો પડે છે.
- \* જે મળે તે કામ સ્વીકારી લેવું પડે છે. પછી ભલેને તે કામ અસલામત કે વધુ સમય માંગી લે તેવું હોય.
- \* મફત તબીબી સારવારનો પણ તે બરાબર ઉપયોગ કરી શકતી નથી. કારણકે તેને મજૂરી ગૂમાવીને કે ધર છોડીને જવાનું પોસાતું નથી.
- \* તેના જીવન સંધર્ષમાં તે એટલી વ્યસ્ત હોય છે કે તેને નવું નવું શીખીને આવડત કેળવવાનો સમય નથી મળતો.
- \* સમાજમાં ગરીબ હોવાને કારણે તેને ઓછું મહત્વ મળે છે.
- \* ગરીબીને લીધે સ્ત્રીને જીવતા રહેવા માટે પુરુષ પર આધાર રાખવો પડે છે, તેણે પુરુષોને ખુશ રાખવા માટે બધું જ કરવું પડે છે; જેમકે તેની માર્પીટ સહેન કરવી, ઈચ્છા વિરુદ્ધ અસલામત સંભોગ સહેવો પડે, વગેરે.



ગરીબી, સામાજિક અસમાનતા, કામનો બોઝે તથા જતીય જવાબદારી શ્રીઓનું અનારોગ્ય વધારે છે.

મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.


### ૩.૧ સમાજમાં સ્ત્રીઓનો ઉત્તરતો દરજાએ

સામાજિક દરજાએ એટલે સમાજ, કુટુંબ અને જ્ઞાતિમાં સ્ત્રીને મળતી મહત્ત્વાત્મકતા. તેને મળતા ઓછા કે બધું મહત્વની સીધી અસર તેની પ્રવૃત્તિઓ, નિર્ણય શક્તિ અને તેના સ્વાભિમાન પર પડે છે. દુનિયામાં બધે જ સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછું સ્થાન મળે છે. તેને કારણે સમાજમાં બેદ્ભાવનું વાતાવરણ ઉભું થાય છે. ફક્ત સ્ત્રી હોવાને લીધે તેને ઓછું માન મળે કે ઓછી તકો મળે છે. આ બધાની અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે.

દરેકને દીકરો જોઈએ : આપણી સામાજિક વ્યવસ્થા એવી ગોઠવાઈ છે, જેથી છોકરો કમાણી કરી કુટુંબ માટે પૈસા લાવે, ઘરડાં માતા-પિતાને પાસે રાખે, તેઓ મરી જય ત્યારે ઉત્તરકિયા કરે અને કુટુંબનો વંશ જળવી રાખે. જ્યારે છોકરીઓને પરણીને સાસરે જવાનું હોય છે તેથી તે આ બધું પોતાના પિતાના કુટુંબ માટે કરી શકે નહીં. આના કારણે નાનપણમાં છોકરીઓની યોગ્ય કાળજી લેવાતી નથી. જેમ કે, ઘણા કુટુંબોમાં છોકરીઓને માતાનું ધાવણ ઓછો સમય મળે, ખાવાનું ઓછું મળે, તબીબી સારવાર ઓછી મળે અને ઓછું શિક્ષણ મળે અથવા બિલકુલ ના મળે.

સ્ત્રીઓને પોતાના નિર્ણયો કરવાની છૂટ નથી. : પારંપરિક રીતે/ચાલતા આવેલા રિવાજ મુજબ સ્ત્રીઓને પિતાની ભિતકત મળતી નથી, સાસરીમાં તે પોતાની અંગત કમાણી રાખી શકતી નથી, તેને ધિરાણ મળતું નથી. સ્ત્રીને કાયદાકીય રક્ષણ હોવા છતાં રિવાજને કારણે તે આ બધું કરી શકતી નથી. ઘરમાં પૈસા ખર્ચવા બાબતે કે તબીબી સારવાર મેળવવા, બહાર જવા માટે કે સામાજિક પ્રસંગોમાં જવા અંગે તે પતિને પૂછ્યા વગર નિર્ણય કરી શકતી નથી. સ્ત્રીઓ કરે છે તેમાંના મોટા ભાગના કામ માટે પૈસા મળતા નથી. સ્ત્રીઓનું કામ સમાજમાં કામ તરીકે ગણાતું નથી અને ઘરની બહાર કામ કરતી સ્ત્રીઓ સંગઠિત ક્ષેત્રોમાં નથી જઈ શકતી તેથી તેમનું આર્થિક પાસું નબળું જ રહે છે. આજ કાલ સ્વસહાયજૂથોમાં સંગઠિત થનાર સ્ત્રીઓને આવક માટે અને બીજી કામો માટે તેમના નામે ધિરાણ મળી શકે છે. છતાં હકીકત એ છે કે મોટા ભાગની બેનોએ કેટલી બચ્યત કરવી, કેટલા પૈસા ઉપાડવા, કયા કામ માટે આ પૈસા વાપરવા લોન-ધિરાણ કર્યારે અને કેટલું લેવું, ભરપાઈ કરવા માટે હપ્તા જમા કરાવવા બાબત તથા તેમાંથી ઊભા થયેલા આવકના સાધન પર પતિ-પુત્રનું જ નિયંત્રણ રહે છે.

આમ દેરેક વસ્તુ માટે પુરુષ પર નિર્ભર રહેતી સ્ત્રી પોતાની તબિયત જળવવા માટે જરૂરી વસ્તુઓની માંગ ઉઠાવી શકતી નથી. જેમકે કુટુંબનિયોજન, સલામત જતીય સંબંધ, પૂરતું પોષણદાયક ખાવાનું અને



હિંસામુકત વાતાવરણ મેળવવા તેણે સંઘર્ષ કરવો પડે છે. આવા ભેદભાવને કારણે સ્ત્રીઓને પુરુષોની દીચછા મુજબ બાળકોને જન્મ આપવો પડે છે. બાળકો હોય તો જ તેને કુટુંબમાં કાંઈક થોડું પણ મહત્વ મળતું થાય છે. વારંવાર અને ઉપરાઉપરી સુવાવડોને કારણે સ્ત્રીનું શરીર નબળું પડે છે. પરંતુ કુટુંબનિયોજનના સાધનો પણ તે પોતાની મરજુ પ્રમાણે વાપરી શકતી નથી. ઘણી વાર તે પોતાની જરૂરિયાત પ્રમાણે આરોગ્ય સેવા પણ લઈ શકતી નથી. કુટુંબની મર્યાદિત આવક પતિ, બાળકો અને



સાસરાપક્ષના હિતાર્થે વાપર્યા બાદ પણ પોતાના સ્વાસ્થ્ય પર તે ખર્ચ કરી શકતી નથી. ઘણી મોટી ઉંમરે પણ તેના તમામ નિર્ણયો પિતા, પતિ કે પુત્ર જ લે છે.

**બેનોનું કામ :** દુનિયાની કુલ વસ્તીમાં અડધી સ્ત્રીઓ છે. દુનિયામાં થતા કામના દરેક દસ કલાકમાંથી સ્ત્રીઓ આઠ કલાક કામ કરે છે. શ્રમશક્તિ અહેવાલ છતાં તેને દુનિયાની આવકનો દસમો ભાગ મળે છે અને દુનિયાની મિલકતમાં એકસોમો ભાગ જ મળે છે. ઘર અને કુટુંબને આર્થિક સંધરતા અપાવવા માટે તે ઘર ઉપરાંત બહારનું કામ પણ કરે છે. છતાં

તેની આર્થિક પરિસ્થિતિ નબળી જ રહે છે. મિલકત કે વારસાઈમાં તેને ન્યાયી હિસ્સો મળતો જ નથી.

આવી પરિસ્થિતિમાં લુવતી સ્ત્રીઓ જતે જ સમાજમાં નીચું સ્થાન સ્વીકારી લે છે. નબળું સ્વાસ્થ્ય કુદરતી ઘટનાની જેમ તેઓ સ્વીકારી લે છે. બિમારી બહુ ગંભીર ના થઈ જાય ત્યાં સુધી કોઈજ ફરિયાદ કરતી નથી કે સારવાર લેતી નથી.

આપણી તબીબી સેવાઓ સ્ત્રીઓ માટે જરૂરી સેવાઓ પૂરી પાડતી નથી.

### 3.2 અપૂર્ણી અને દુર્લભ તબીબી સેવાઓ

ગરીબ દેશોમાં લોકોને સારી આરોગ્ય સેવાઓ મળતી નથી. તેમાં ય વળી ભેદભાવના વાતાવરણમાં સ્ત્રીઓને જરૂરી સેવાઓ પર સરકાર પોતાનું મર્યાદિત નાણાંબંડોળ ખર્ચતી નથી. કૌટુંભિક નાણાં પણ સ્ત્રીઓ માટે આવશ્યક સેવાઓ પર ખર્ચી શકતા નથી. આપણી તબીબી સેવાઓ સ્ત્રીઓને જરૂરી સેવાઓ પૂરી પાડતી નથી. વળી સ્ત્રીઓ માટેની સેવાઓ ખાસ ડૉક્ટરો જ આપી શકે તેવા વાતાવરણમાં આરોગ્ય રક્ષકોને તાલીમ આપી પાયાની સેવાઓ પણ ગ્રામ્ય કક્ષાએ બરાબર રીતે આપવામાં આવતી નથી.


મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

### મીરા કેમ મરી ગઈ ?

મીરા જ્યારે નાની હતી ત્યારે તેને સરસ પતિ મેળવી સુખ સગવડવાળા ઘરમાં રહેવાની આશા હતી. તેનું કુટુંબ બહુ ગરીબ હતું. તે તેના પિતાની સૌથી નાની ને ચોથી છોકરી હતી તથા તેનો પિતા દાડું પીને ઘણીવાર માતાને અને તેને ભારતો હતો.

જ્યારે મીરા ૧૪ વર્ષની થઈ ત્યારે તેનું લગ્ન થઈ ગયું. એ છોકરાના પિતા પાસે થોડી જમીન હતી. મીરાને પતિની પસંદગી કરવાનો કોઈ મોકો હતો નહિ. અતિશય કામ, મજૂરી અને લગ્નજીવનના બોઝ હેઠળ મીરા દબાઈ ગઈ. ત્યારે ૩૮ તેને ઘ્યાલ આવી ગયો કે તેના સ્વખ ક્યારેય પૂરા થવાના નથી.

મીરાના પતિને શિક્ષ પર નાના નાના ભસા (Warts) હતા જેથી તેને જાતીય સંબંધ વખતે તકલીફ થતી તેથી મીરાને સંબંધ જરાય ગમતો નહોતો, છતાં તેણે આપી લુંઢગી આ સંબંધ નિભાવ્યો. મીરાને બીજી સુવાવડમાં છોકરો અવતર્યો તેથી તેનો પતિ ખુશ હતો. તે હવે તેને વારંવાર સંભોગ માટે સત્તાવતો નહીં, છતાં તેને બીજા ૬ બાળકો થયાં, જેમાંથી બે મરી ગયાં. હવે તે ૪૦ વર્ષની થઈ હતી. લુવન અગાઉની કેમ ચાલતું હતું. એક દિવસ મીરાને માસિકનો સમય ન હોવા છતાં યોનિમાર્ગ લોહી વહેવા લાગ્યું. મીરા ડરી ગઈ અને પતિ પાસે તબીબી સારવાર માટે ડૉક્ટરને મળવાની ઠિચ્છા બતાવી તો પતિએ પૈસા આપવાની ના પાડી, તેથી થોડા દિવસ પછી મીરાએ તેની બેનપણી પાસેથી થોડાક પૈસા ઉધાર લીધા ને આરોગ્ય કેન્દ્રમાં ગઈ. ત્યાં તેને થોડી દવા આપી તથા તેની બિમારી વિશે કોઈ સમજણ આપ્યા વગર તેને ઘરે મોકલી દીધી. તેને સાંદ્ર ન થયું. ઉલ્ટાની મીરા નાસ્તીપાસ થઈ કે તેણે નકામા તેના અને તેની બેનપણીના પૈસા બગાડ્યા.




તેની પરિસ્થિતિ વધુને વધુ બગડવાથી તેના પતિને પણ લાગ્યું કે હવે તો દવાખાને જવું જ પડશે. તેથી થોડાક પૈસા ઉધાર લઈને શહેરની હોસ્પિટલમાં તેને લઈ ગયો. ત્યાં જુદી જુદી તપાસ થઈ. ઘણાં દિવસ પછી મીરાને તેઓએ કહ્યું કે તેને કેન્સર થયું છે અને તે ખૂબ આગળ વધી ગયું છે. હવે તેને માટે સારવાર કરાવવા બીજા દૂરના મોટા શહેરમાં જવું પડે. ડૉક્ટરોએ તેને સમયસર દવાખાને ના આવવા ઠપકો આપ્યો. હવે સારવાર માટે મોડું થઈ ગયું હતું. તેનો રોગ સુધરવાની આશા નહોતી તેથી તેને ઘરે લઈ ગયા. મીરા બે માસ બાદ સારવાર વિના ૩૮ મૃત્યુ પામી.


## શ્રીઓનું સ્વાસ્થ્ય નબજું હોવાના કારણો

**ચર્ચા કરીએ કે મીરા કેમ મરી ગઈ ?**

ગરીબ સ્ત્રીઓ કેમ જુદા જુદા રોગોથી પિડાય છે અને મરી જય છે તેના ઘણા કારણો છે.  
(જુઓ કેન્સર વિશે વધુ માહિતી અન્યત્ર આપેલ છે)



આવી કેટલીય કડીઓ જોડાઈને બનેલ સાંકળને લીધે મીરા મરી ગઈ.



આ બધા જવાબો ખરા હોવા છીતાં તે મીરાના પ્રશ્નો વિશે ભર્યાદિત સમજણ પ્રગટ કરે છે કારણકે તેઓ મીરા કે તેના પતિને દોષિત ડેરવે છે. ખરેખર તો મીરા એક ગરીબ સ્ત્રી હતી અને તે એક ગરીબ અને વ્યવસ્થાહીન વિસ્તારમાં રહેતી હતી તે જ તેના મરણનું સાચું કારણ છે.

\* પેપ્ટોસ્ટ : ગર્ભાશયના મુખના કેન્સરની વહેલી ખબર પડે તે માટે કરવામાં આવતો સરળ ટેસ્ટ.

૧૯૭૦ ના દાયકમાં આપણા દેશમાં પદ્ધિમના પૈસાદાર દેશોની બેંકોમાંથી ઘણું કરજ લેવાયું હતું, જેનો ઉપયોગ નવા નવા પ્રોજેક્ટ શક્ક કરવા માટે થયો હતો. આ બેંકોને જ્યારે નાણાં પરત કરવાનો સમય થયો ત્યારે આપણે અર્થતંત્રમાં માળખાગત અનુકૂલન કાર્યક્રમો લેવા પડ્યા. જેથી લોકોએ ઉત્પન્ન કરેલ મહા મૂલી મૂઠી આ દેવા ભરપાઈ કરવામાં ખર્ચાવા લાગી. તેના પરિણામે શાળા, આરોગ્ય કેન્દ્ર અને દવાખાના ચલાવવા માટે અગાઉ કરતાં હવે ઓછા નાણાં સરકાર ફકાળવે છે. તેથી ગરીબ માણસો પર વધુ અસર થાય છે. તેમાંથી ગરીબ સ્ત્રીઓ અને બાળકો પર સૌથી વધુ અસર થાય છે. ગરીબોની રહીસહી મૂઠી ખાનગી તબીબી સેવાઓ પાછળ ખર્ચાઈ જય છે. આમ ગરીબ વધુ ગરીબ બને છે.

મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

ગરીબી અને નીચું સામાજિક સ્થાન કેવી રીતે મીરાના મૃત્યુનું કારણ બન્યા :

મીરાનું કુટુંબ ગરીબ હોવાથી તેને નાની ઉમરે પરણાવી દીધી અને તેને બહુ વહેલા જતીયળવન શરૂ કરવું પડ્યું. તેના પતિ પર તેનું કોઈ જ નિયંત્રણ ન હોવાથી તે ગમે તે સ્ત્રી સાથે સંબંધ રાખતો. ગરીબીને કારણે તે કુપોષિત હતી અને તેનું શરીર રોગોનો માર સહી શકે તેવું નહોતું.

મીરાના ગામમાં આરોગ્ય સેવાઓ નહોતી તથા નજીકના કેન્દ્ર પરથી મળી શકે તેવી માહિતી તેની પાસે નહોતી. કુટુંબનિયોજન તથા જતીય રોગથી બચવાના ઉપયોગી પણ તે અજાણ હતી. વળી ત્યાંના નર્સ/ડૉક્ટર કાર્યકરોને યોનિ તપાસ કરતાં આવડતું નહોતું, તેથી તેઓ કેન્સર જેવા રોગને પારખી શક્યા નહીં. તેથી મીરા દવાખાને/આરોગ્યકેન્દ્ર પર ગઈ હતી છતાં તેને કોઈ ખાસ મદ્દ મળી નહીં. માટે મીરાને મોટા શહેરના દવાખાને ખૂબ ખર્ચ વેઠીને જવું પડ્યું, પણ ત્યાં સુધીમાં ખૂબ મોહું થઈ ગયું હતું.

વળી મીરા એક ગરીબ દેશમાં જન્મી છે. મર્યાદિત નાણાંભંડોળને સરકાર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર ખર્ચવાને બદલે બીજી પ્રક્રિયા પર ખર્ચ કરે છે. જે થોડા પૈસા સરકારે સ્ત્રી સ્વાસ્થ્ય પર ફાળવ્યા તે મોટી હોસ્પિટલ અને ડૉક્ટરો પર ખર્ચ થઈ ગયા. સામૂદ્દર્યિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અપૂરતા નાણાં અને અપૂરતી તાલિમ સાથે સ્ત્રીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખી ના શકે એ સ્પષ્ટ છે.

આમ ગરીબી અને નીચું સામાજિક સ્થાન તેને ત્રણ સ્તર પર નહીં. તેના કુટુંબમાં, સમાજમાં અને દેશમાં તેથી જ તેનું મરણ નીપજ્યું એમ કહેવાય.



#### ૪.૦ પરિવર્તન માટે પ્રયાસ

પરિસ્થિતિ આવી જ રહે એ દુર્ઘટનીય નથી. નબળા સ્વાસ્થ્યના કારણો કુટુંબ, સમાજ અને રાષ્ટ્રીય કક્ષાએ પડેલા હોવાથી ત્રણોય કક્ષાએ કામ કરવું પડશે અને પરિવર્તન લાવવું પડશે.

#### ૪.૧ સામાજિક/કૌટુંભિક ફેરફાર

તમારા પતિ/પતિની સાથે એકબીજની જરૂરિયાતો અંગે ચર્ચા કરો. બજે એકબીજનું સ્વાસ્થ્ય સુધારવા શું કરી શકે તેનો વિચાર કરો. જેમ કે સલામત જતીય સંબંધ, ધરમાં કાર્યભારની વહેંચાણી, બાળકોનો ઉછેર, વગેરે.

તમે તમારી અને અન્ય લીઓની તબિયત આ પુસ્તક વાંચીને સુધારી શકો છો. આરોગ્યના નાના મોટા પ્રશ્નો વિશે એકબીજા સાથે ચર્ચા કરવાથી તેના ઉપાયો મળી આવે છે. લીઓને પોતાના વિષે વાત કરવાની ખૂબ શરમ આવે છે અને તેઓ કોઈને પોતાના વિષે કહેતી નથી. છતાં વાત કરવાથી જ ઉપાય મળશે એ સમજ લેવું જરૂરી છે. કેટલીક વાર ઘણી બધી લીઓને એક જ જતનો પ્રશ્ન/સમસ્યા/રોગ હોય છે. પણ તેઓને એકબીજાની માહિતી હોતી નથી. માટે નાનકડું જૂથ ભેગું કરી તમારા સમાજમાં આરોગ્યના પ્રશ્નો કયા કયા છે તે અંગે વાતચીત કરો. તે સમસ્યાઓના કારણ સમજને તેમને દૂર કરવાના ઉપાયો વિચારો, તે પ્રમાણે આપોજન કરો અને સમાજમાં પરિવર્તન લાવો.

પુરુષ અને લીને અલગ અલગ સામાજિક પરિસ્થિતિમાં જીવવાનું હોય છે. તેથી એક જ રોગ/સમસ્યા માટેના ઉપાયો અલગ અલગ હોઈ શકે છે.

એકરી ઉપર પાણી ચઢાવવાથી મારી કમર અને પીંડમાં સખત દુખાવો થાય છે. આરોગ્ય રક્ષક કહે છે મહિના રહ્યા હોય ત્યારે સખત કામ ના કરશો. પણ ધરમાં પાણી માટે બીજુ શું કરું ?

મને મહિના નથી તોય પાણી ભરવાથી મારી કમર પણ બહુ દુખતી હતી. છેવટે મેં મારા પતિ સાથે વાત કરી પાણી ભરવામાં તેમની મદદ મેળવી.

હું મારી બેનને ત્યાં ગઠ હતી. બધી બેનોએ ભેગા થઈ સરકાર પાસે બસ્તીની નજીક નળ મૂકાવ્યા છે.

આપણે આવું જ કરવું જોઈએ. તેને માટે ધણા લોકો ભેગા કરવા પડે. સરકારમાં કોને વાત કરવી તે પણ આપણને ખબર નથી. શું કરીશું ?

આપણે જ્યોતિબેન, શિક્ષિકાને પૂછી જોઈએ તેઓ જરૂર રસ્તો બતાવશો.



ઘણી બેનો સાથે ચર્ચા કરવાથી તમને પણ ઘણું નવું જણવાનું ને શીખવાનું મળશે.

મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

#### ૪.૨ બાળકોનો સારો ઉછેર કેવી રીતે કરવો

##### ખોટો ઉછેર



##### સાચો ઉછેર



આપણે બાળકોને શીખવીએ છીએ કે સ્ત્રીઓ અને છોકરીઓ ભૂખી રહે તો કાંઈ વાંધો નહીં. માટે નાનપણથી છોકરીઓને ઉપવાસ કરતાં શીખવીએ છીએ.

આપણા પુત્રને હિંસાના પાઠો ભણાવવાથી તે ખોટો થઈ સ્ત્રીઓ પર હિંસા આચરતાં અચકાતો નથી. આપણે પડોશીની પત્નિને માર પડતો હોય ત્યારે વિરોધ ના કરીએ તો આપણો દીકરો શીખે કે પત્નિને મારવામાં વાંધો નથી.

આપણે પુત્રી પાસે બધું ઘરકામ કરાવીએ, પુત્રને રમવા જવા દઈએ, તેથી પુત્ર સમજે છે કે ઘરકામમાં મદદ કરવાની કોઈ જરૂર નથી/તે તો માત્ર સ્ત્રીઓનું જ કામ છે.

આપણે દીકરાને માંગે તે લાવી આપીએ અને દીકરીને તે વસ્તુ વિના ચલાવી લેવાનું કહીએ તેથી દીકરો શીખે છે કે કેટલાક અધિકારો છોકરીઓને/સ્ત્રીઓને ના આપીએ તો ચાલે.

આપણા દીકરાને આપણે એક સારા પતિ કે સારા પિતા થવા માટે સ્ત્રીઓ/છોકરીઓ સાથે સહદ્યી બનતાં શીખવીએ.

આપણા દીકરાને બધી સ્ત્રીઓ અને તેની પત્નિનો પણ આદર કરતાં અત્યારથી જ શીખવીએ. તે માટે દરેક પુરુષે પોતાની માતા, પત્નિ અને દીકરીનું માન જળવતાં શીખવું પડશે.

આપણી દીકરીઓને આપણે ભણાવીએ તેથી તેનો વિકાસ થશે, તે સારી માતા/પત્ની બનશે અને સારો સમાજ બનાવશે. આપણી દીકરીને અત્યારથી જ અન્યાયનો વિરોધ કરતાં શીખવીએ.

આપણા દીકરાને ઘરનું કામ વહેંચતા શીખવીએ. જેથી તેની બહેન, દીકરી કે પત્નિને વધુ પડતા કામનો બોનો સહેવો ના પડે. પિતા ઘરકામમાં મદદ કરશે તો પુત્ર પણ તેમ કરતા શીખશે. તેથી પિતાનું માનસ પરિવર્તન પણ જરૂરી છે.

### ૪.૩ પુરુષોની મદદ લો



ઘરૂળીવાર સ્ત્રીઓના પ્રશ્ને પુરુષો સાથે વાત કરવાથી ઘરણા કામો સહેલાઈથી ઉકલી શકાય છે. એવા પુરુષોને તમારા જીથસાથે રાખો કે જેમનું ગામમાં/સમાજમાં માન હોય. બીજા પુરુષોનો આદર પામતા હોય તેવા પુરુષો સ્ત્રીઓની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ રીતે ચર્ચા-વિચારણામાં ભળી શકે તો સારું પરિણામ મળી શકે છે.

### પુરુષો કેવી રીતે મદદ કરી શકે

સમાજમાં સારો દાખલો બેસાડવા માટે તેઓ

- ★ સ્ત્રીઓની જિટ્ટિંગમાં પુરુષો દખલ ન કરે તેનું ધ્યાન રાખી શકે. બીજા પુરુષો પોતાની પતિનિયોને જીથમાં ભળવા હેતુમાં સમજલવી શકે અને સ્ત્રીઓને પ્રોત્સાહન આપી શકે.
- ★ સ્ત્રીઓ મહિલા મંડળ બનાવી નાના-મોટા જાહેર કામો કરે તેવું ગોઠવી શકે.
- ★ દાડિંદ્ધી અને વ્યસનમુક્તિ માટે પુરુષો સ્ત્રીઓની સાથે કામ કરી શકે.
- ★ સ્ત્રીઓને મારપીઠના કિસ્સાઓમાં પુરુષોને સમજલવી શકે.
- ★ એકથી વધુ સ્ત્રીઓ સાથે સંબંધ રાખનાર પુરુષ તાકાતવાન છે એ માન્યતા તોડવા મહેનત કરે, કારણકે એક જ સ્ત્રી સાથે વિશ્વસનીય સંબંધ જણવનાર પુરુષ સારો પતિ બની શકે છે. તે પુરુષ વધુ મજબૂત છે.

કુટુંબમાં તે કેવી રીતે મદદ કરી શકે ?

- ★ પોતાના બાળકોને માતા-બહેન-દાદી, વગેરે સ્ત્રીઓનો આદર કરતાં શીખવે.
- ★ નાની-મોટી કૌટિભિક બાબતો જેવી કે, દીકરા-દીકરીનું ભણતર, વિવાહ કે લગ્ન, સામાજિક પ્રસંગોમાં હાજરી કોણ આપે, બેટ કેવી આપવી, ઘરના માસિક ખર્ચી, વગેરે અંગે સ્ત્રીઓનો મત લીધા બાદ સામૂહિક નિર્ણય કરવાની આદત પાડે.
- ★ પોતાની પતિનિયોના સાથે કેટલા બાળક હોવા જેઠાં તે અંગે ચર્ચા કરે અને કુટુંબ નિયોજનની જવાબદારી લે.
- ★ પતિનિયોના સાથે વિશ્વસનીય સંબંધ રાખે.
- ★ જે તેમને કોઈ પણ જતીય રોગ થાય તો તે અંગે પતિનિયોના વિશ્વાસમાં લઈ જરૂરી સારવાર તરત કરાવે.
- ★ પોતાના તમામ બાળકોને ભણવા મોકલે. તેઓના વ્યક્તિગત વિકાસમાં ધ્યાન આપે.

મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

#### ૪.૪ ગામમાં/સમાજમાં સ્ત્રી-સ્વાસ્થ્ય સુધારવા શું કરશો ?

- ★ મહિતીનો પ્રસાર કરવો. રોગ, તેને અટકાવવાના ઉપાય અને શક્ય હોય ત્યાં તેની સારવાર અંગે લોકોને જગૃત કરો.
- ★ મહિલા-જૂથોની રચના કરી તેઓ સ્ત્રીઓના સ્વાસ્થ્ય અંગે કામ કરી શકે તેવી ગોઠવણ કરો.
- ★ સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર જીવન જીવી શકે તે માટે રોજગારી મળી રહે તેવી તાતીમો અને ઉત્પાદન કાર્યોનું આચોજન કરવા પ્રયત્ન કરો.

ગામોમાં સ્વચ્છતા જળવવા શૌચાલય, પીવાનું પાણી, કૂવાના થાળા બાંધવા, જહેર રસ્તાની સુધારણા કરવી, હેન્ડપ્રમ્પનું સમારકામ કરવાનું, તેવા કામો હાથપર લેવા જેઠાં.




અમદાવાદમાં ભારપીઠનો ભોગ બનેલ સમસ્યાઓથી શોષિત સ્ત્રીઓ માટે એક સામાજિક સંસ્થા છે. તેમનો ઉદ્દેશ છે, હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને મદદ કરવી. તેમણે નાનકડું ઘર બનાવ્યું છે જેમાં ભારપીઠનો ભોગ બનેલ સ્ત્રી અને બાળકો રહી શકે છે. મહિલાજૂથ તેમનું રક્ષણ કરે છે અને તેમને પુનઃસ્થાપન કરવાનો (થાળે પાડવાનો) પ્રયત્ન કરે છે. તેઓ જનજગૃતિના કામો કરે છે અને પુરુષો વધુ સંવેદનશીલ બને તે માટે પ્રયત્ન કરે છે.



વડોદરા શહેરમાં સ્ત્રીઓની બનાવેલી હસ્તકલાની વસ્તુઓ વેચવા માટે હસ્તકલા સહકારી બંડાર ચાલુ કરેલ છે. તેમાંથી હવે બેનોને પુરુષો કરતાં વધુ આવક મળે છે. તેથી પુરુષો પણ હવે સ્ત્રીઓનો આદર કરતા થયા છે. સ્ત્રીઓ સરળતાથી કામ કરી શકે તે માટે ઘરમાં ને ગામમાં સગવડ કરી આપે છે. સ્ત્રીઓ જ્યારે કામ પર હોય ત્યારે બાળકો સાચવવા, નિશાળે મૂકવા-લેવા જવું, રસોઈકામ, સફાઈ વગેરે કામો પુરુષો કરતા થયા છે.

**૪.૫ આટલું તો કરો જ.**

- શ્રીઓને ફેફસાંની બિમારીથી બચાવવા માટે નિર્ભૂમ ચૂલા બનાવવાનું કામ શક્ષ કરો. આ ચૂલા ઓછા બળતણથી રસોઇ કરે છે અને પાઈપ વાટે ધુમાડો બહાર નીકળી જવાથી શ્રીઓને ધુમાડામાં સખડવું પડતું નથી.
- શ્રીઓને સગર્ભાવસ્થાની તકલીફ, સુવાપહમાં જોખમ થવાથી અને અસુરક્ષિત ગર્ભપાતના કારણે ભરી જતાં બચાવવા માટે ગામભાંથી દ્વારાખાને લઈ જવા તત્કાળ વાહનની વ્યવસ્થા કરો.
- કેન્સરની વહેલી ખબર પડે તે માટે ઓછા ખર્ચવાળી સહેલી પદ્ધતિઓ (જેવી કે પેપેસ્ટ, સ્તનની જત-તપાસ શીખવવી) નું આયોજન કરો.
- કુટુંબ નિયોજનની સેવાઓ તથા પ્રસૂતિ પૂર્વની સંભાળની વ્યવસ્થા ગોઠવવાથી શ્રીઓને ઘણો ફાયદો થાય છે.
- આરોગ્ય કેન્દ્રના ટેકાથી આરોગ્ય રક્ષકોને સારી તાતીમ અપાવો જેથી શ્રીઓને સમયસર અને અસરકારક માર્ગદર્શન મળી રહે.
- શ્રીઓને નિઃસંકોચ રીતે નહાવા માટે નાવણિયા (ચારેબાજુથી બરાબર બંધ થઈ શકે તેવા) બનાવવાનું કામ હાથ પર લઈ શકાય.
- શ્રીઓના પ્રશ્નો પર કામ કરતા નારીવાદી જૂથોની વાતો સમજવાનો અને લોકોને સમજવવાનો પ્રયત્ન કરો.



મહિલા સ્વાસ્થ્ય એક સામાજિક મુદ્દો છે.

## સ્ત્રીઓના નબળા સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો

સામાજિક	રાજકીય-આર્થિક	વાતાવરણ	શારીરિક
<ul style="list-style-type: none"> <li>ઓછું અથવા નહિપત્ર શિક્ષણ</li> <li>આજો દિવસ ઘર અને બાળકોમાં વ્યસ્ત રહેવું પડે.</li> <li>બીજી સામાજિક જવાબદારીઓ જીવી માટે બંધનરૂપ છે.</li> <li>પરણીને પારકા ઘરમાં જરૂરું પડે છે અને ત્યાં અજાણ્યા લોકો માટે સમયનો ભોગ દેવો પડે છે.</li> <li>નવા ઘરે તેનું સ્થાન બધાથી ઉત્તરતું હોય છે.</li> <li>કોઈપણ નિર્ણય તે પોતાની જાતે નથી કરી શકતી.</li> <li>તેના હાથમાં પૈસા હોતા નથી અને હોય તો પોતે પોતાની રીતે ખર્ચ કરી શકતી નથી.</li> <li>નાનપણથી જ તોણે પરણીને સાસરે જવાનું છે તેને કારણે એક પ્રકારના સતત કર સાથે જ તે ઉછેરે છે. તેથી લઘુતાત્રણી અને પરાવલમ્બિતા ના ગુણા તે કેળવે છે.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ઘરની બહાર કામ કરવા સમય અને તકોનો અભાવ છે.</li> <li>નક્કી કરેલી સેવાઓમાં ફ્રેન્ટીય સ્તરની ભૂમિકા મળે છે.</li> <li>સરખા કામ માટે પુરખો કરતાં ઓછું વેતન મળે છે.</li> <li>સ્વાસ્થ્ય સેવાઓ અત્યંત મૌંધી અને દૂર હોય છે.</li> <li>દવાઓ ખર્ચાળ છે તે લેવા માટે દૂર દૂર જરૂરું પડે.</li> <li>વાહન-વ્યવહાર અસરકારક અને અનુકૂળ નથી.</li> <li>સેવાઓના કામનો સમય સાનુકૂળ નથી.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>પ્રદૂષણ ચુક્કત વાતાવરણ અનેક રોગ આપે છે.</li> <li>પિતુપ્રધાન સમાજમાં સ્ત્રીએ પુરખના તાબે રહેવું પડે છે.</li> <li>રસ્તા ખરાબ છે. સંચાર માદ્યમો અસરકારક નથી.</li> <li>વીજળી નિયમિત નથી હોતી.</li> <li>જંગલમાં લાકડા લેવા કે ઢોર માટે ઘાસ લેવા કે પાણી ભરવા માટે ખૂબ શ્રમ કરવો પડે છે.</li> <li>વૃદ્ધો માટે સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ અનુકૂળ નથી.</li> <li>કામના સ્થળે સ્ત્રીલક્ષી સેવાકીય માળખાનો અભાવ હોય છે.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>કુપોષિત હોવાથી રોગની તીવ્રતા વધુ હોય છે.</li> <li>પ્રજનન માર્ગના રોગ સ્ત્રીઓને વધુ જલ્દી થાય છે.</li> <li>શ્રમના પ્રમાણમાં ખોરાકનો જથ્થો ઓછો હોવાથી કેલરીની ઘટ ચાલુ જ રહે છે.</li> <li>ઉપરાઉપરી સુવાપડ થવાથી શરીર નબળુ પડે છે.</li> <li>સ્વાસ્થ્યની હિંસા વેઠવી પડે છે. દા.ત. બિમારીમાં મોડી સારવાર, સ્ત્રી ભૃણાહત્યા, પતિ અને સાસરિયાનો માર તથા ઉત્પીડન, વગેરે</li> <li>સ્ત્રીસ્વાસ્થ્ય પ્રત્યે નિષ્કાળજી, ઉછેરમાં ભેદભાવ, ઘરડી બેનોને સારવાર ના મળે, વગેરે.</li> </ul>

